

ધારીરિક ખોટામાંપણ ધરાવતા ઉમેદવારો માટે સીધી ભરતીમાં રાખવામાં આવતી અનામત જગ્યાઓ તેમજ ઉપલી વયમર્યાદામાં આપવામાં આવતી છૂટછાટ માટે આપવામાં આવતા વિકલાંગતા(disability)અંગેના પ્રમાણપત્રનો નમુનો નિયત કરવા બાબત.

ગુજરાત સરકાર,
સામાન્ય વહીવટ વિભાગ,
પરિપત્ર ક્રમાંક:-૫૨૪/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ.૨,
સચિવાલય, ગાંધીનગર.
તારીખ:-૧/૧૨/૨૦૦૮.


પરિપત્ર:-

કેન્દ્ર સરકારના વિકલાંગ(સમાન તક, અધિકારોનું રક્ષણ અને પુર્ણ ભાગીદારી)ધારા-૧૯૯૫ ની જોગવાઈ ધ્યાને લઈને સામાન્ય વહીવટ વિભાગના તા.૧૯/૨/૨૦૦૦ ના જાહેરનામાથી વિકલાંગ વ્યક્તિઓ માટે નોકરીમાં ૩(ત્રણ) ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના તા.૫/૧/૬૫ ના ઠરાવ અને વાપતોવખાના સુધારાઓ-૧ જોગવાઈઓ મુજબ વિકલાંગ વ્યક્તિઓને સીધી ભરતીથી નિમજૂંક માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે. આ જોગવાઈઓ મુજબ સરકારી સેવાઓ અને જગ્યાઓના ભરતી નિયમો મુજબ નિમજૂંક માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો તરફથી વિકલાંગતા(disability)અંગે રજૂ કરવામાં આવતા તબીબી પ્રમાણપત્રોની ચકાસણીમાં ગુજરાત જાહેર સેવા આયોગ તેમજ અન્ય ભરતી એજન્સીઓને સરળતા રહે તેમજ એકસૂત્રતા જાળવાય તે હેતુથી વિકલાંગતા અંગેના પ્રમાણપત્રોનો નમુનો નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તદ્અનુસાર પ્રસ્તુત બાબતે ભારત સરકાર ધ્વારા નિયત કરવામાં આવેલ વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની વિગતો ધ્યાને લઈને આ સાથે સામેલ પરિશિષ્ટ-અ' મુજબનો વિકલાંગતા અંગેના પ્રમાણપત્રનો નમુનો નિયત કરવામાં આવે છે.

૨. ઉપરોક્ત હેતુ માટે હવેથી વિકલાંગ વ્યક્તિ માટે રાજ્યની જિલ્લા સરકારી હોસ્પિટલોના અધિકારીઓ / સિવિલ સર્જનોએ આ સાથે સામેલ કરેલ નમૂના મુજબ વિકલાંગતા અંગેના પ્રમાણપત્રો આપવાના રહેશે, ગુજરાત જાહેર સેવા આયોગ તેમજ અન્ય ભરતી એજન્સીઓ ધ્વારા સીધી ભરતીથી નિમજૂંક માટે ઉમેદવારો પાસેથી અરજીપત્રકો મંગાવવા માટે આપવામાં આવતી જાહેરાતોના સંદર્ભમાં વિકલાંગ ઉમેદવારો તરફથી કરવામાં આવતી અરજીઓ સાથે ઉમેદવારોએ આ સાથે સામેલ પરિશિષ્ટ-અ' મુજબનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર(Disability Certificate) રજૂ કરવાનું રહેશે.

૩. આ હુચનારો રાજ્યની સર્વે જિલ્લા સરકારી હોસ્પીટલોના અધિકારીઓ / સિવિલ સર્જનો તેમજ રાજ્યની તમામ ભરતી એજન્સીઓ તેમજ રાજ્યના તમામ જાહેર ઉપદ્યો / નિગમોની ભરતી એજન્સીઓના ધ્યાને લાવવા તેમજ તેના અમલ માટે જરૂરી સૂચનાઓ આપવા સચિવાલયના સંબંધિત વિભાગોને આથી આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી રાને તેમના નામે,



(આઈ.એન.સોલંકી),
નાયબ સચિવ,
સામાન્ય વહીવટ વિભાગ,
ગુજરાત સરકાર.

બિડાસ્ટ:- પરિશિષ્ટ-અ'

પ્રતિ,

રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર.

મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી, ગાંધીનગર.

વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી.

તમામ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી.

x સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ.

x સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.

x સચિવશ્રી, ગુજરાત તહેદારી આયોગ, ગાંધીનગર.

x રજિસ્ટ્રારશ્રી, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ.

x સચિવશ્રી, ગુજરાત મુદ્દી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.

x સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પરિષદગી મંડળ, ગાંધીનગર.

x સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પરિષદગી મંડળ, અમદાવાદ.

x સચિવશ્રી, ગુજરાત રાજ્ય માહિતી આયોગ, ગાંધીનગર.

સચિવાલયના સર્વે વિભાગો(પાંચ નહીં).

સર્વે જિલ્લા સરકારી હોસ્પીટલોના અધિકારી, સિવિલ સર્જનશ્રી,


સામાન્ય વહીવટ વિભાગની તમામ શાખાઓ/અધિકારીશ્રીઓ,

સીલેક્ટ ફાઈલ-ગ. ૨ શાખા, સામાન્ય વહીવટ વિભાગ.

x પત્ર ધ્વારા.

NAME & ADDRESS OF THE INSTITUTE / HOSPITAL
 Certificate No. _____ Date : _____
DISABILITY CERTIFICATE

This is to certify that Shri / Smt. / Kum. _____ Son/wife/daughter of Shri _____
 Age : _____ Sex _____ identification mark (s) is suffering from
 permanent disability of following category :-



- A. Locomotor or cerebral palsy :**
- (i) BL - Both legs affected but not arms (a) Impaired reach
 - (ii) BA - Both arms affected (b) Weakness of grip
 - (iii) BLA - Both legs and both arms affected (a) Impaired reach
 - (iv) OL - One leg affected (right or left) (b) Weakness of grip
 - (v) OA - One arm affected (c) Ataxic
 - (vi) BH - Stiff back and hips (cannot sit or stoop) (a) Impaired reach
 - (vii) MW - Muscular weakness and limited physical endurance. (b) Weakness of grip
- B. Blindness or Low Vision** (i) B - Blind
(ii) PB - Partially Blind
- C. Hearing Impairment.** (i) D - Deaf
(ii) PD - Partially Deaf

(DELETE THE CATEGORY WHICHEVER IS NOT APPLICABLE)

2. This condition is progressive / non-progressive / likely to improve / not likely to improve. Reassessment of this case is not recommended / is recommended after a period of _____ years _____ months. (Strik out which is not applicable).

3. Percentage of disability in his/her case is _____ Percent.

4. Shri / Smt. / Kum. _____ meets the following physical requirements for discharge of his / her duties :-

- | | |
|--|--------|
| (i) F-can perform work by manipulating with fingers | Yes/No |
| (ii) PP-can perform work by pulling and pushing | Yes/No |
| (iii) L-can perform work by lifting | Yes/No |
| (iv) KC-can perform work by kneeling and cratching | Yes/No |
| (v) B-can perform work by bending | Yes/No |
| (vi) S-can perform work by sitting (on bench or chair) | Yes/No |
| (vii) ST-can perform work by standing | Yes/No |
| (viii) W-can perform work by walking | Yes/No |
| (ix) SE-can perform work by seeing | Yes/No |
| (x) H-can perform work by hearing/speaking | Yes/No |
| (xi) RW-can perform work by reading and writing | Yes/No |

Supintendent / Civil Surgeon
 Govt. Hospital (With Seal)